




॥ अटुसंढदलकुषु ढुखणुठ सुधु ॥

ऑफुकरु



Pramukhji Shreni

100 Verses Gujarati

Satsang Pravrutti Central Office, Africa


|| Shri Swaminarayan Vijayate ||




Bhagwan Swaminarayan and Aksharbrahman Gunatitanand Swami
(Shri Akshar-Purushottam Maharaj)




**Brahmaswarup
Bhagatji Maharaj**




**Brahmaswarup
Shastriji Maharaj**



**Brahmaswarup
Yogiji Maharaj**




**Brahmaswarup
Pramukh Swami Maharaj**



Pragat Brahmaswarup Mahant Swami Maharaj

I CAN, I WILL, I MUST
(C W M)

Sadhu Keshajivandas



Goal: Memorize 100 Shloks

Date	Milestone	Mukhpath Shloks	Total Shloks
Sunday, 28 Mar 2021	Pragji Bhata Jayanti	24	24
Sunday, 25 Apr 2021	Swaminarayan Jayanti	16	40
Sunday, 06 Jun 2021	Yogi Jayanti	32	70
Sunday, 11 Jul 2021	Rathyatra	28	100
Sunday, 18 Jul 2021	Guru Purnima	Revision	100

१. स्वामिनारायण भगवान् એટલે કે સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે. (૧)

Swāminārāyaṇ Bhagwān eṭale ke sākṣhāt Akṣhar-Puruṣhottam Mahārāj sarvane param shānti, ānand ane sukh arpe. (1)

૨. આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. (૨)

Ā deh muktinu sādhan chhe, keval bhognu sādhan nathī. Durlabh ane nāshvant evo ā deh vāramvār maḷato nathī. (2)

૩. લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે. તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. (૩)

Laukik vyavahār to dehnā nirvāh māṭe chhe. Te ā manuṣhya janmanu param lakṣhya nathī. (3)

૪-૫. સર્વ દોષોને ટાળવા, બ્રહ્મસ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો. (૪-૫)

Sarva doṣhone ṭālavā, brahma-sthitine pāmavā ane Bhagwānnī bhakti karavā ā deh maḷyo chhe. Ā badhu satsang karavāthī avashya prāpta thāya chhe. Āthī mumukṣhuoe sadāya satsang karavo. (4-5)

૬. તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત્ અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. (૬)

Tethī Parabrahma Swāminārāyaṇe ā lokmā sākṣhāt avatarīne ā divya satsangnī sthāpanā karī. (6)

७. आ सत्संगनुं ज्ञान मुमुक्षुओने थाय अेवा शुभ आशयथी 'सत्संगदीक्षा' अे नामनुं शास्त्र रयवामां आवे छे. (७)

Ā satsangnu gnān mumukṣhuone thāya evā shubh āshayathī 'Satsang-Dikṣhā' e nāmnū shāstra rachavāmā āve chhe. (7)

८-८. सत्य अेवा आत्मानो संग करवो, सत्य अेवा परमात्मानो संग करवो, सत्य अेवा गुरुनो संग करवो अने सख्खास्त्रनो संग करवो अे सत्संगनुं सायुं लक्ष्ण ज्ञाणवुं. आवो दिव्य सत्संग करनार मनुष्य सुभी थाय छे. (८-८)

Satya evā ātmāno sang karavo, satya evā Paramātmāno sang karavo, satya evā guruno sang karavo ane sachchhāstrano sang karavo e satsangnu sāchu lakṣhaṇ jāṇavu. Āvo divya satsang karanār manuṣhya sukhī thāy chhe. (8-9)

१०. दीक्षा अेटले दृढ संकल्प, श्रद्धाअे सहित अेवो अयण निश्चय, सम्यक् समर्पण, प्रीतिपूर्वक निष्ठा, व्रत अने दृढ आशरो. (१०)

Dikṣhā eṭale dṛuḍh sankalp, shraddhāe sahit evo achal nishchay, samyak samarpaṇ, prīti-pūrvak niṣṭhā, vrat ane dṛuḍh āsharo. (10)

११. स्वाभिनारायण भगवानने विषे अनन्य, दृढ अने परम भक्ति माटे आश्रयदीक्षा मंत्र ग्रहण करी सत्संग प्राप्त करवो. (१८)

Swāminārāyaṇ Bhagwāne viṣhe ananya, dṛuḍh ane param bhakti māṭe āshraya-dikṣhā-mantra grahaṇ karī satsang prāpta karavo. (18)

१२. आश्रयदीक्षा मंत्र आ प्रमाणे छे:

धन्योस्मि पूर्णकामोस्मि निष्पापो निर्भयः सुधी।
अक्षरगुरुयोगेन स्वामिनारायणश्रयात्॥ (१८)

Āshraya-dīkshā mantra ā pramāṇe chhe:

Dhanyosmi pūrṇakāmosmi niṣhpāpo nirbhayah sukhī ।

Akṣhara-guru-yogena Swāminārāyaṇ-āshrayāt ॥ (19)

१३. आ संसारमां ब्रह्मस्वरूप गुरु विना ज्वनमां ब्रह्मविद्यानो तत्त्वे करीने
साक्षात्कार न थई शके. (२२)

Ā sansārmā brahmaswarūp guru vinā jīvanmā brahma-vidyāno
tattve karīne sākṣhātkār na thaī shake. (22)

१४. अक्षरब्रह्म गुरु विना परमात्मानो उत्तम निर्विकल्प निश्चय न थई शके तथा
पोताना आत्माने विषे ब्रह्मभाव पण प्राप्त न थई शके. (२३)

Akṣharbrahma guru vinā Paramātmāno uttam nirvikalp
nishchay na thaī shake tathā potānā ātmāne viṣhe brahmabhāv
paṇ prāpta na thaī shake. (23)

१५. ब्रह्मस्वरूप गुरु विना यथार्थ भक्ति पण न थई शके, परम आनंदनी प्राप्ति
न थाय अने त्रिविध तापनो नाश पण न थाय. (२४)

Brahmaswarūp guru vinā yathārth bhakti paṇ na thaī shake,
param ānandnī prāpti na thāy ane trividh tāpano nāsh paṇ na
thāy. (24)

૧૬. આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો. (૨૫)

Āthī sarva arthnī siddhi kare tathā Paramātmāno anubhav karāve tevā pratyakṣ Akṣharbrahma guruno āsharo sadāy karavo. (25)

૧૭. અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. (૮૬)

Akṣharādhipati Swāminārāyaṇ Bhagwān sākṣhāt Paramātmā Parabrahma Puruṣhottam Hari chhe. (96)

૧૮. એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઈષ્ટદેવ છે. તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. (૮૭)

E ek ja āpaṇā sadā param upāsyā iṣṭadev chhe. Temanī ja ananya bhāve sadā bhakti karavī. (97)

૧૯. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્ સનાતન અક્ષરબ્રહ્મ છે. એ અક્ષરબ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે. (૮૮)

Guṇātītānand Swāmī sākṣhāt sanātan Akṣharbrahma chhe. E Akṣharbrahmanī paramparā āje paṇ virājamān chhe. (98)

૨૦. સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીથી આરંભાયેલ ગુરુપરંપરામાં આવેલ પ્રગટ અક્ષરબ્રહ્મ એ એક જ આપણા ગુરુ છે. (૮૯)

Sampradāymā Guṇātītānand Swāmīthī ārambhāyēl guru-paramparāmā āvel pragaṭ Akṣharbrahma e ek ja āpaṇā guru chhe. (99)

૨૧. આપણા ઈષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે - એમ આપણી સદા એકતા છે. (૧૦૦)

Āpaṇā iṣṭadev ek ja chhe, guru ek ja chhe ane siddhānt paṇ ek ja chhe em āpaṇī sadā ekatā chhe. (100)

૨૨. બ્રહ્મવિદ્યારૂપ, વૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો. (૧૦૧)

Brahma-vidyārūp, Vaidik ane sanātan evā divya Akṣhar-Puruṣhottam siddhāntne jāṇavo. (101)

૨૩-૨૪. જીવ, ઈશ્વર, માયા, અક્ષરબ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્ત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુઓએ જાણવું - એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. (૧૦૨-૧૦૩)

Jīv, īshwar, māyā, Akṣharbrahma tathā Parabrahma e pānch tattvo sadāy bhinna chhe, nitya chhe, satya chhe em mumukṣhuoe jāṇavu - em swayam Swāminārāyaṇ Bhagwāne spaṣṭa siddhānt karyo chhe. (102-103)

૨૫. તેમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી થાય છે. (૧૦૪)

Temā Akṣhar ane Puruṣhottam e be sadāy māyāthī par chhe ane jīvo tathā īshwaronī mukti temanā yogthī thāy chhe. (104)

૨૬. પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષરબ્રહ્મથી પર છે અને અક્ષરબ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસભાવે સેવા કરે છે. (૧૦૫)

Paramātmā Parabrahma sadā Akṣharbrahmthī par chhe ane Akṣharbrahma paṇ te Paramātmānī nitya dāsabhāve sevā kare chhe. (105)

૨૭. ભગવાન સદાય સર્વકર્તા, સાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશાં પ્રગટ રહે છે. (૧૦૬)

Bhagwān sadāy sarva-kartā, sākār, sarvoparī chhe ane mumukṣhuonī mukti māṭe hammeshā pragaṭ rahe chhe. (106)

૨૮. અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાનાં સકળ ઐશ્વર્યો સહિત, પરમાનંદ અર્પતાં થકાં સદાય પ્રગટ રહે છે. (૧૦૭)

Akṣharbrahma-swarūp guru dvārā Bhagwān potānā sakal aishvaryo sahit, paramānand arpatā thakā sadāy pragaṭ rahe chhe. (107)

૨૯. અક્ષરબ્રહ્મ ગુરુને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી. તેમને વિષે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવાં. (૧૦૮)

Akṣharbrahma gurune viṣhe dṛuḍh prīti ane ātmabuddhi karavī. Temane viṣhe pratyakṣ Bhagwānno bhāv lāvīne bhaktie karīne temanī sevā tathā dhyān karavā. (108)

૩૦-૩૧. સ્વામિનારાયણ મંત્ર દિવ્ય, અલૌકિક અને શુભ મંત્ર છે. સ્વયં શ્રીહરિએ આ મંત્ર આપ્યો છે. સર્વ ભક્તોએ તેનો જપ કરવો. આ મંત્રમાં 'સ્વામિ' શબ્દથી અક્ષરબ્રહ્મને સમજવા અને 'નારાયણ' શબ્દથી તે અક્ષરબ્રહ્મથી પર એવા પુરુષોત્તમને સમજવા. (૧૦૯-૧૧૦)

Swāminārāyaṇ mantra divya, alaukik ane shubh mantra chhe. Swayam Shriharie ā mantra āpyo chhe. Sarva bhaktoe teno jap karavo. Ā mantramā 'Swāmi' shabdathī Akṣharbrahmane samajavā ane 'Nārāyaṇ' shabdathī te Akṣharbrahmathī par evā Puruṣhottamne samajavā. (109-110)

उ२-उ३. आ सिद्धांत भगवान् स्वामिनारायणे आ लोकमां प्रबोध्यो. गुणातीत गुरुओमे तेनुं दिगंतमां प्रवर्तन कर्तुं. शास्त्रीञ्च महाराजे तेने मूर्तिमान् कर्तुं. गुरुओना जवनचरित्र-ग्रंथोमां तेनी पुनः दृढता कराववामां आवी. आ सिद्धांतने गुरुहरि प्रमुखस्वामी महाराजे पोताना हस्ताक्षरथी लक्ष्मी स्थिर कर्तुं. साक्षात् गुरुहरिना प्रसंगथी आ सिद्धांत जवनमां प्राप्त करी शक्य छे. ते आ सनातन मुक्तिप्रद सिद्धांतने ज दिव्य 'अक्षरपुरुषोत्तम दर्शन' कहेवामां आवे छे. (१११-११४)

Ā siddhānt Bhagwān Swāminārāyaṇe ā lokmā prabodhyo. Guṇātīt guruoe tenu digantmā pravartan karyu. Shāstrīñ Mahārāje tene mūrtimān karyo. Guruonā jīvan-charitra-granthomā tenī punah dṛḍhatā karāvavāmā āvī. Ā siddhāntne guruhari Pramukh Swāmī Mahārāje potānā hastākṣharthī lakhī sthir karyo. Sākṣhāt guruharinā prasangthī ā siddhānt jīvanmā prāpt karī shakāy chhe. Te ā satya sanātan muktiprad siddhāntne ja divya 'Akṣhar-Puruṣhottam Darshan' kahevāmā āve chhe. (111-114)

उ६. आवा परम दिव्य सिद्धांतनुं चिंतवन करतां करतां निष्ठाथी अने आनंद-उत्साहपूर्वक सत्संग करवो. (११५)

Āvā param divya siddhāntnu chintavan karatā karatā niṣṭhāthī ane ānand-utsāh-pūrvak satsang karavo. (115)

उ७. त्रश देहथी विलक्षण एवा पोताना आत्माने विषे ब्रह्मरूपनी विभावना करी सदैव परब्रह्मनी उपासना करवी. (११६)

Traṣ dehthī vilakṣhaṇ evā potānā ātmāne viṣhe brahmarūpnī vibhāvanā karī sadaiv Parabrahmanī upāsana karavī. (116)

३८. ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ ન જોવો, કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. (૧૩૧)

Bhagwān tathā gurune viṣhe manuṣhyabhāv na jovo. Kāraṇ ke Akṣhar ane Puruṣhottam banne māyāthī par chhe, divya chhe. (131)

૩૯. ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ દઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. (૧૩૨)

Bhagwān tathā gurune viṣhe vishvās dṛuḍh karavo, nirbaltāno tyāg karavo, dhīraj rākhavī tathā Bhagwānnu baḷ rākhavu. (132)

૪૦. મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો. (૧૩૪)

Mumukṣhuoe pratyakṣh Akṣharbrahma guruno prasang sadā param prīti ane divyabhāvthī karavo. (134)

૪૧. અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે દઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. (૧૩૫)

Akṣharbrahma-swarūp gurune viṣhe dṛuḍh prīti e ja brāhmī sthiti tathā Bhagwānnā sākṣhātkārne pāmavānu sādhan chhe. (135)

૪૨. અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત્ કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. (૧૩૬)

Akṣharbrahma gurunā guṇo ātmasāt karavā māṭe tathā Parabrahmanī anubhūti māṭe Akṣharbrahma gurunā prasangonu sadāy manan karavu. (136)

४३. मन-कर्म-वचने गुरुहरिनुं सदा सेवन करवुं अने तेमने विषे प्रत्यक्ष नारायणस्वरूपनी भावना करवी. (१३७)

Man-karma-vachane guruharinu sadā sevan karavu ane temane viṣhe pratyakṣh Nārāyaṅswarūpnī bhāvanā karavī. (137)

४४. सत्संगीअे क्यारेय बणरहित वात सांभणवी नहीं अने करवी पण नहीं. हुंमेशां बण भरेली वातो करवी. (१३८)

Satsangīe kyārey baḷ-rahit vāt sāmbhaḷavī nahī ane karavī paṅ nahī. Hammeshā baḷ bharelē vāto karavī. (138)

४५. प्रेमे करीने तथा आदर थकी ब्रह्म अने परब्रह्मना महिमानी तथा तेमना संबंधवाणाना महिमानी वातो निरंतर करवी. (१३९)

Preme karīne tathā ādar thakī Brahma ane Parabrahmanā mahimānī tathā temanā sambandh-vāḷānā mahimānī vāto nirantar karavī. (139)

४६. मुमुक्षुअे सत्संगीओने विषे सुहृदभाव, दिव्यभाव तथा ब्रह्मभाव राखवा. (१४०)

Mumukṣhue satsangīone viṣhe suhṛudbhāv, divyabhāv tathā brahmabhāv rākhavā. (140)

४७-४८. परमात्मा परब्रह्म स्वामिनारायण भगवान, अक्षरब्रह्मस्वरूप गुणातीत गुरु, तेमण्णे आपेल दिव्य सिद्धांत तथा तेमना आश्रित भक्तोनो विवेके करीने सदाय पक्ष राखवो. (१४१-१४२)

Paramātmā Parabrahma Swāminārāyaṅ Bhagwān, Akṣharbrahma-swarūp guṅātīt guru, temaṅe āpel divya siddhānt tathā temanā āshrit bhaktono viveke karīne sadāy pakṣh rākhavo. (141-142)

४८. प्रतिदिन स्थिर चित्ते अंतदृष्टि करवी के हुं आ लोकमां शुं करवा आव्यो छुं?
अने शुं करी रह्यो छुं? (१४५)

Pratidin sthir chitte antardrūṣṭi karavī ke hu ā lokmā shu
karavā āvyo chhu? Ane shu karī rahyo chhu? (145)

५०. 'अक्षररूप थईने हुं पुरुषोत्तमनी भक्ति करुं' ऐम पोताना लक्ष्यनुं चिंतन
आणस राभ्या वगर रोज करवुं. (१४६)

'Akṣharrūp thaīne hu Puruṣhottamnī bhakti karu' em potānā
lakṣhyanu chintan āḷas rākhyā vagar roj karavu. (146)

५१-५२. आ स्वामिनारायण भगवान सर्वकर्ताहर्ता छे, सर्वोपरी छे, नियामक छे. तेओ
मने अहीं प्रत्यक्ष मय्या छे. आथी ज हुं धन्य छुं, परम भाग्यशाणी छुं, कृतार्थ
छुं, निःशंक छुं, निश्चिंत छुं अने सदा सुभी छुं. (१४७-१४८)

Ā Swāminārāyaṇ Bhagwān sarva-kartā-hartā chhe, sarvoparī
chhe, niyāmak chhe. Teo mane ahī pratyakṣ malyā chhe. Āthī ja
hu dhanya chhu, param bhāgyashālī chhu, kṛtārth chhu,
nihshank chhu, nishchint chhu ane sadā sukhī chhu. (147-148)

५३. आ रीते परमात्मानी दिव्य प्राप्तिनुं, महिमानुं तथा तेमनी प्रसन्नतानुं चिंतन
दररोज स्थिर चित्ते करवुं. (१४९)

Ā rīte Paramātmānī divya prāptinu, mahimānu tathā temanī
prasannatānu chintan dar-roj sthir chitte karavu. (149)

५४. पोताना आत्माने त्रण देह, त्रण अवस्था तथा त्रण गुणथी जुदो समञ्ज तेनी
अक्षरब्रह्म साथे ऐकतानी विभावना प्रतिदिन करवी. (१५०)

Potānā ātmāne traṇ deh, traṇ avasthā tathā traṇ guṇthī judo
samajī tenī Akṣharbrahma sāthe ekatānī vibhāvanā pratidin
karavī. (150)

૫૫. દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતવન કરવું. (૧૫૧)

Dar-roj jagatnā nāshavant-pañānu anusandhān karavu ane potānā ātmānī nityatā tathā sachchidānand-pañānu chintavan karavu. (151)

૫૬. જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે, તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ થયું છે એમ માનવું. (૧૫૨)

Je thaī gayu chhe, thaī rahyu chhe ane je kāñī āgaḷ thashe te badhu ja Swāminārāyaṇ Bhagwāññī ichchhāthī mārā hit māṭe ja thayu chhe em mānavu. (152)

૫૭. માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ ઈત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે ‘હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું’ એમ શાંત મને ચિંતવન કરવું. (૧૫૪)

Mān, irṣhyā, kām, krodh ityādi doṣhono āveg āve tyāre ‘Hu Akṣhar chhu, Puruṣhottamno dās chhu’ em shānt mane chintavan karavu. (154)

૫૮. અને સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે એમ બળ રાખવું. (૧૫૫)

Ane sarva doṣhonu nivāraṇ karanārā sākṣhāt Swāminārāyaṇ Bhagwān sadaiv māri sāthe chhe em baḷ rākhavu. (155)

૫૯. અસત્ય ક્યારેય ન બોલવું. હિત કરે તેવું સત્ય બોલવું. અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું. (૧૬૪)

Asatya kyārey na bolavu. Hit kare tevu satya bolavu. Anyanu ahit kare tevu satya paṇ na bolavu. (164)

૬૦. સુખમાં છકી ન જવું અને દુઃખમાં ઉદ્વેગ ન પામવો. કારણ કે બધું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી પ્રવર્તે છે. (૧૬૯)

Sukhmā chhakī na javu ane dukhmā udveg na pāmavo. Kāraṇ ke badhu Swāminārāyaṇ Bhagwānnī ichchhāthī pravarte chhe. (169)

૬૧. કુમાર તથા યુવાન અવસ્થામાં વિશેષ સંયમ પાળવો. શક્તિનો નાશ કરે એવા અયોગ્ય સ્પર્શ, દૃશ્ય વગેરેનો ત્યાગ કરવો. (૨૧૩)

Kumār tathā yuvān avasthāmā viśeṣh sanyam pālavo. Shaktino nāsh kare evā ayogyā sparsh, ḍrūshya vagereno tyāg karavo. (213)

૬૨. ધર્મ-નિયમ પાળવાથી જીવન ઉન્નત થાય છે અને અન્યને પણ સદાચાર પાળવાની પ્રેરણા મળે છે. (૨૭૪)

Dharma-niyam pālāvāthī jīvan unnat thāy chhe ane anyane paṇ sadāchār pālāvānī prerāṇa maḷe chhe. (274)

૬૩. શુભ તથા અશુભ પ્રસંગોને વિષે મહિમાએ સહિત પવિત્ર સહજાનંદ નામાવલીનો પાઠ કરવો. (૨૭૬)

Shubh tathā aśhubh prasangone viṣhe mahimāe sahit pavitra Sahajānand Nāmāvalīno pāṭh karavo. (276)

૬૪. અક્ષરબ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પુરુષોત્તમની દાસભાવે ભક્તિ કરવી એ મુક્તિ માનવામાં આવી છે. (૨૯૧)

Akṣharbrahmanu sādharma prāpt karī Puruṣhottamnī dāsabhāve bhakti karavī e mukti mānavāmā āvī chhe. (291)

૬૫. ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારાં સર્વે સંકટોના ટાળનારા છે. (૪૪)

Bhagwān sarva-kartā chhe, dayālu chhe, sarvanu rakṣhaṇ karanārā chhe ane e ja sadā mārā sarve sankṭonā ṭālanārā chhe. (44)

૬૬. ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઈચ્છા એ જ મારાં પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે. (૪૫)

Bhagwān je kare te sadāy sārā māṭe hoy. Temanī ichchhā e ja māru prārabdha chhe. Teo ja mārā tārak chhe. (45)

૬૭. મારાં વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. (૪૬)

Mārā vighno, pāp, doṣh tathā durguṇo avashya nāsh pāmashe. Hu avashya shānti, param ānand ane sukh pāmīsh. (46)

૬૮. કારણ કે મને સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ. (૪૭)

Kāraṇ ke mane sākṣhāt Akṣhar-Puruṣhottam Mahārāj maḷyā chhe. Temanā baḷe hu jarūr dukhne tarī jaīsh. (47)

૬૯. આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે. (૪૮)

Ā rīte vichārnu baḷ rākhī āshrit bhakta kyārey himmat na hāre ane Bhagwānnā baḷe ānandmā rahe. (48)

७०. निंदा, लज्जा, भय के मुश्केलीओने लीधे क्यारेय सत्संग, स्वामिनारायण भगवान, तेमनी भक्ति अने गुरुनो त्याग न करवो. (१२१)

Nindā, lajjā, bhay ke mushkelīone līdhe kyārey satsang, Swāminārāyaṇ Bhagwān, temanī bhakti ane guruno tyāg na karavo. (121)

७१. सत्संगनो आशरो पोताना दुर्गुणोने टाणवा, सदगुणोने प्राप्त करवा अने पोताना परम कल्याण माटे करवो. (१२६)

Satsangno āsharo potānā durguṇone ṭāḷavā, sadguṇone prāpt karavā ane potānā param kalyāṇ māṭe karavo. (126)

७२. स्वामिनारायण भगवान तथा गुणातीत गुरुओनी प्रसन्नता प्राप्त करवा सदा सत्संगनो आशरो करवो. (१२७)

Swāminārāyaṇ Bhagwān tathā guṇātīt guruonī prasannatā prāpt karavā sadā satsangno āsharo karavo. (127)

७३. अहो! आपणने अक्षर अने पुरुषोत्तम भंने अही ज मय्या छे. तेमनी प्राप्तिना केइथी सत्संगना आनंदने सदाय माणवो. (१२८)

Aho! Āpaṇne Akṣhar ane Puruṣhottam banne ahī ja maḷyā chhe. Temanī prāptinā keḥṭhī satsangnā ānandne sadāy māṇavo. (128)

७४-७५. भगवान अने ब्रह्मस्वरूप गुरुनी आज्ञानुं सदाय पालन करवुं. तेमनी अनुवृत्ति जाणोने तेने दृढपणे अनुसरवुं. तेमनी आज्ञा आणस वगेरे मूडीने पाणवी, तरत पाणवी; सदा आनंद, उत्साह अने मडिमा साथे तेमने राख करवाना भावथी पाणवी. (१४३-१४४)

Bhagwān ane brahmaswarūp gurunī āgnānu sadāy pālan karavu. Temanī anuvṛutti jāṇīne tene ḍṛḍhapaṇe anusaravu. Temanī āgnā ālas vagere mūkīne pāḷavī, tarat pāḷavī; sadā

ānand, utsāh ane mahimā sāthe temane rājī karavānā bhāvthī pālāvī. (143-144)

७६. पुरुषो क्यारेय कुदृष्टिअे करीने स्त्रीओने न जुअे. ते ज रीते स्त्रीओ पश कुदृष्टिअे करीने पुरुषोने न जुअे. (१८०)

Puruṣho kyārey kudruṣṭīe karīne strīone na jue. Te ja rīte strīo paṣ kudruṣṭīe karīne puruṣhone na jue. (180)

७७. धर्म अने संस्कारोनो नाश करे अेवां अश्लील दृश्यो जेमां आवतां डोय तेवां नाटको के चलचित्रो वगेरे क्यारेय न जेवां. (१८५)

Dharma ane sanskārono nāsh kare evā ashlīl druṣhyo jemā āvatā hoy tevā nāṭako ke chal-chitro vagere kyārey na jovā. (185)

७८. आ लोकमां संग भणवान छे. जेवो संग डोय तेवुं ज्वन बने. आथी सारा मनुष्योनो संग करवो. कुसंगनो सर्वथा त्याग करवो. (२१६)

Ā lokmā sang baḷavān chhe. Jevō sang hoy tevu jāvan bane. Āthī sārā manuṣhyono sang karavo. Kusangno sarvathā tyāg karavo. (216)

७९. अक्षरपुरुषोत्तम मडाराजने विषे दढ निष्ठा राखवी. तेम छतां कोई पश अन्य देवोनी निंदा न करवी. (२५२)

Akṣhar-Puruṣhottam Mahārājne viṣhe druḍh niṣṭhā rākhavī. Tem chhatā koī paṣ anya devonī nindā na karavī. (252)

८०. अन्य धर्मो, संप्रदायो के तेमना अनुयायीओने विषे द्वेष न करवो. तेमनी निंदा न करवी. तेमने सदा आदर आपवो. (२५३)

Anya dharmo, sampradāyo ke temanā anuyāyīone viṣhe dveṣh na karavo. Temanī nindā na karavī. Temane sadā ādar āpavo. (253)

८१. विपत्ति आवे त्पारे धीरज राखवी, प्रार्थना करवी, प्रयत्न करवो अने अक्षरपुरुषोत्तम महाराजने विषे दृढ विश्वास राखवो. (२८०)

Vipatti āve tyāre dhīraj rākhavī, prārthanā karavī, prayatna karavo ane Akṣhar-Puruṣhottam Mahārājne viṣhe dṛuḍh viśhvās rākhavo. (280)

८२. सारा झणने आपे तेवुं, उन्नति करे तेवुं अने उचित डोय तेवुं ज साडस करवुं. जे केवण पोताना मननुं अने लोकोनुं रंजन करे तेवुं साडस न करवुं. (२१४)

Sārā faṅne āpe tevu, unnati kare tevu ane uchit hoy tevu ja sāhas karavu. Je kevaḷ potānā mannu ane lokonu ranjan kare tevu sāhas na karavu. (214)

८३-८४. श्रीहरिअे शुद्ध उपासना-लक्तिनां पोषण अने रक्षण माटे मंदिर निर्माणरूप लक्तिनुं प्रवर्तन कर्युं. अने भगवाननी जेम ज तेमना उत्तम लक्त अेवा अक्षरब्रह्मनी भगवाननी साथे सेवा करवा माटे आज्ञा करी. (८७-८८)

Shrīharie shuddha upāsanā-bhaktinā poṣhaṅ ane rakṣhaṅ māṭe mandir nirmāṅrūp bhaktinu pravartan karyu. Ane Bhagwānnī jem ja temanā uttam bhakta evā Akṣharbrahmanī Bhagwānnī sāthe sevā karavā māṭe āgnā karī. (87-88)

८५. अक्षरब्रह्म भगवानना उत्तम लक्त छे, कारण के तेओ नित्य मायापर छे अने नित्य भगवाननी सेवामां रममाण डोय छे. (८९)

Akṣharbrahma Bhagwānnā uttam bhakta chhe, kāraṅ ke teo nitya māyāpar chhe ane nitya Bhagwānnī sevāmā ramamaṅ hoy chhe. (89)

૮૬-૮૭. તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષરબ્રહ્મની મૂર્તિ પણ વિધિવત્ સ્થાપવામાં આવે છે. (૮૦-૮૧)

Te āgnāne anusarīne sarvanu kalyāṇ thāy te hetuthī divya mandironu nirmāṇ bhakti-bhāvthī karavāmā āve chhe ane tenā madhya-khaṇḍmā Puruṣhottam Bhagwānī mūrtinī sāthe Akṣharbrahmanī mūrti paṇ vidhivat sthāpavāmā āve chhe. (90-91)

૮૮. એ જ રીતે ઘર આદિ સ્થળોને વિષે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં હંમેશાં અક્ષરબ્રહ્મ સહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે. (૮૨)

E ja rīte ghar ādi sthālone viṣhe kareḷ mandiroṃā paṇ madhyamā hammeshā Akṣharbrahma sahit Puruṣhottam Bhagwāne prasthāpit karavāmā āve chhe. (92)

૮૯. આજ્ઞા-ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો સર્વજીવહિતાવહ છે, દુઃખવિનાશક છે અને પરમસુખદાયક છે. (૨૮૭)

Āgnā-upāsanā sambandhī ā siddhānto sarva-jīva-hitāvah chhe, dukh-vināshak chhe ane param-sukh-dāyak chhe. (287)

૯૦. જેઓને સત્સંગનો આશ્રય થયો છે તેમનું કાળ, કર્મ કે માયા ક્યારેય અનિષ્ટ કરવા સમર્થ થતાં જ નથી. (૨૭૭)

Jeone satsangno āshray thayo chhe temanu kāl, karma ke māyā kyārey aniṣṭ karavā samarth thatā ja nathī. (277)

८१. કાળ, કર્મ આદિનું કર્તાપણું ન માનવું. અક્ષરપુરુષોત્તમ મહારાજને સર્વકર્તા માનવા. (૨૭૯)

Kāl, karma ādinu kartāpaṇu na mānavu. Akṣhar-Puruṣhottam Mahārājne sarva-kartā mānavā. (279)

૮૨. એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું. તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. (૨૫૬)

Ekādashīnu vrat sadāy param ādar thakī karavu. Te divase niṣhiddha vastu kyārey na jamavī. (256)

૮૩. વચનામૃત, સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુઓનાં જીવનચરિત્રો નિત્યે ભાવથી વાંચવાં. (૨૩૬)

Vachanāmṛut, Swāmīnī Vāto tathā guṇātīt guruonā jīvan-charitro nitye bhāvthī vāanchavā. (236)

૮૪. પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે દશમો કે વીશમો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા-પ્રસન્નતા માટે અર્પણ કરવો. (૧૯૫)

Potāne prāpt thatī āvakmāthī potānī shakti pramāṇe dashmo ke vīshmo bhāg Swāminārāyaṇ Bhagwānī sevā-prasannatā māte arpaṇ karavo. (195)

૮૫. પુરુષે સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો. (૧૮૩)

Puruṣhe samīp sambandh vinānī strīno sparsh na karavo. Te ja rīte strīe potāne samīp sambandh vinānā anya puruṣhno sparsh na karavo. (183)

८६. आपत्काण प्राप्त थतां अन्यनी रक्षा माटे स्पर्श करवामां दोष नथी. परंतु जो आपत्काण न होय तो सदाय नियमोनुं पालन करवुं. (१८४)

Āpatkāḷ prāpt thatā anyanī rakṣhā māṭe sparsh karavāmā doṣh nathī. Parantu jo āpatkāḷ na hoy to sadāy niyamonu pālan karavu. (184)

८७. जेणे करीने कामवासना वृद्धि पामे तेवी वातो के गीतो न सांभलवां, पुस्तको न वांचवां तथा तेवां दृश्यो न जोवां. (१८८)

Jeṇe karīne kām-vāsanā vṛuddhi pāme tevī vāto ke gīto na sām̄bhalavā, pustako na vānchavā tathā tevā drushyo na jovā. (188)

८८. गृहस्थ सत्संगीं माता-पितानी सेवा करवी. प्रतिदिन तेमनां यरणोमां नमस्कार करवा. (१७२)

Gruhasth satsangīe mātā-pitānī sevā karavī. Pratidin temanā charaṇomā namaskār karavā. (172)

८९. मुमुक्षु पोताना आत्मानी मुक्ति माटे सहजानंद श्रीहरि तथा अक्षरब्रह्म स्वरूप गुणतीत गुरुनो प्रीतिं करीने आशरो करे. (२०)

Mumukṣhu potānā ātmānī mukti māṭe Sahajānand Shrihari tathā Akṣharbrahma swarūp guṇātīt guruno prītie karīne āsharo kare. (20)

१००. सत्संगनो आशरो करी सदाय कंठने विषे काष्ठनी बेवडी माणा धारण करवी तथा सत्संगना नियमो धारण करवा. (२१)

Satsangno āsharo karī sadāy kaṅṭhne viṣhe kāṣṭhñnī bevāḍī tathā dhāraṇ karavī tathā satsangnā niyamo dhāraṇ karavā. (21)



साथे साथे एवे मुखपाठ उपर
मारो रखावरो...
मुखपाठ ना समाचार भजे छे त्यारे
पूजे राम थावु छु

जय श्री स्वामिनारायण।

स्व. ३.

॥ सत्संगदीक्षा मुखपाठ अर्धा ॥
ऑफिका

Blessings
Pramukh Swami Maharaj



Inspirer
Mahant Swami Maharaj